



CAPTAIN POLYPLAST LTD.

REGD.OFFICE : UL-25, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, Rajkot-360 002 (Guj.) India. Tele : +91-9909035390, +91-9909035391
H.O. & WORKS : Survey No. 267, Plot No. 10A, 10B & 11, N.H. No. 27, SHAPAR (Veraval), Dist. Rajkot-360 024 (Gujarat) India. Telefax : +91-2827-253006, 252056
web : www.captainpolyplast.com | e-mail : info@captainpolyplast.com
CIN NO. : L25209GJ1997PLC031985

DATE : 10.11.2025

TO

The Bombay Stock Exchange (BSE Limited)
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai- 400001

Dear Sir / Madam,

Sub: Newspaper Publication of Financial Result for the Quarter and Year Ended 30th September 2025

Pursuant to the requirement of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, attached herewith newspaper publication of financial result for the quarter and year ended 30th September 2025 given in Financial Express Newspaper One Vernacular Language(Gujarati) And Other Nationwide Circulating English Newspaper dated 10.11.2025.

Kindly take note of the above.

Thanking you,

Yours faithfully,

FOR, CAPTAIN POLYPLAST LTD

RAMESHBHAI D. KHICHADIA
MANAGING DIRECTOR
(00087859)

ZENLABS ETHICA LIMITED

Regd. Office: Plot No. 194-195, 3rd floor, Industrial area, Phase II,
Ram Darbar, Chandigarh - 160002
Tel: 0172-4651105, Email: queries@zenlabsethica.com
CIN: L74900CH1993PLC033112 | Website: www.zenlabsethica.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER 2025.

Pursuant to Regulation 33 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015 based on the recommendation of the Audit Committee, the Board of Directors of Zenlabs Ethica Limited ("the Company") at its meeting held on 08th November, 2025 has approved the Un-audited Financial Results for the quarter and half year ended on 30th September, 2025.

The aforementioned Financial Results thereon are available on <https://www.zenlabsethica.com/financials/> and the said financial results can also be accessed by scanning a Quick Response (QR) Code given below:



For ZENLABS ETHICA LIMITED

For Zenlabs Ethica Limited
Date: 08.11.2025
Place: Chandigarh

Sd/-
Sanjay Dhir
Director



Patels Airtemp (India) Limited

Registered Office: 5th Floor, Kalpana Complex, Near Memnagar Fire Station
Navrangpura, Ahmedabad - 380009
CIN: L29190GJ1992PLC017801 E-mail: share@patelsairtemp.com
Phone: +91-276428634/35 Fax: +91-2764286301, Website: www.patelsairtemp.com

Extract of Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2025

(Rs. in Lakhs except EPS)					
Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended	Year ended
		30-09-2025	30-09-2024	30-09-2025	31-03-2025
		Unaudited	Unaudited	Unaudited	(Audited)
1	Total Income from operations	2,204.08	8,187.02	10,460.75	38,781.63
2	Other Income	138.77	32.12	184.43	154.98
3	Total Income (1+2)	2,342.85	8,219.14	10,645.18	38,936.61
4	Profit before Exceptional Items and Tax	170.01	423.39	579.65	2,187.88
5	Profit before Tax	170.01	423.39	579.65	2,187.88
6	Net Profit for the period	66.12	314.68	346.31	1,651.01
7	Total Comprehensive income for the period	60.28	315.92	334.63	1,633.54
8	Paid-up Equity Share Capital/Face value of Rs. 10/- each per Share	547.02	547.02	547.02	547.02
9	Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised)				
	1 Basic (Rs.)	1.21	5.75	6.33	30.18
	2 Diluted (Rs.)	1.21	5.75	6.33	30.18

- Notes:
- The above Unaudited Financial Results for the Quarter and Half Year ended 30th September, 2025 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 8th November, 2025 and the Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company M/s. Parikh & Majumdar (Registration No. 107525W), Chartered Accountants, Ahmedabad.
 - The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2025 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the said Results are available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's website: www.patelsairtemp.com.
 - The detailed Financial Results of the Company for the quarter and half-year ended 30th September, 2025 can be accessed through the below QR Code.

Scan QR Code for Results.



For and on behalf of the Board
For Patels Airtemp (India) Limited
Sanjivkumar N. Patel
Chairman & Managing Director
(DIN: 02794095)

Place : Rakanpur, Dist: Gandhinagar
Date : 8th November, 2025



Regd. Office: 312, Plaza Kalpana Society, 24/147, B-49, Birhana Road
Kanpur, Uttar Pradesh - 208001
Corp. Office: Pakka Nagar, Ayodhya - 224135, Uttar Pradesh
CIN: L24231UP1981PLC005294 | T: +91 7800018989
E: connect@pakka.com | Website: www.pakka.com

STANDALONE & CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE 2nd QUARTER AND HALF YEAR ENDED 30th September, 2025

(Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015)

In compliance with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), the Board of Directors of **Pakka Limited** in its meeting held on 8th day of November 2025 approved Un-Audited (Standalone & Consolidated) Financial Results (UAFRs) of the Company for the 2nd quarter and half year ended at 30th September 2025.

The Un-Audited (Standalone & Consolidated) Financial Results (UAFRs) along with the Limited Review Report by CNK & Associates LLP, Statutory Auditors of the Company are available on the Financial Results tab of Investor Section on the website of the company at www.pakka.com on the following link <https://pakka.com/wp-content/uploads/2025/10/Unaudited-Financial-Results-30th-September-2025.pdf> and also on the website of Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively.

In compliance with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we hereby notify you that the same can also be accessed by scanning the following Quick Response (QR) Code:



for Pakka Limited
Sd/-
Ved Krishna
DIN: 00182260
Date: 08-11-2025
Place: Lucknow

OSBI
Network Technology Department, State Bank of India,
Global IT Centre, 6th Fl., CBO Baitera, Near Mumbai-400 014
Bank's response to Pre-Bid Queries and Corrigendum
Please refer to RFP No. SB/ITC/NTW/Tech/2025-26/1306 dated 18.10.2025 for Procurement of Domain Name System (DNS) Solution of State Bank of India. Bank's Response to Pre-Bid Queries and Corrigendum dated 10.11.2025 can be accessed under Procurement News at Bank's website: <https://www.sbi.co.in> or <https://bank.sbi> or e-Procurement agency portal <https://etenders.sbi/sbi/>
Place: Navi Mumbai
Date: 10.11.2025
Sd/- Deputy General Manager
(Network Technology Dept.)



Vertis Infrastructure Trust (Formerly known as Highways Infrastructure Trust)

SEBI Registration No. IN/INF/721-22/0019
Principal Place of Business: Unit No. 601-602, 6th Floor, Windsor House, off CST Road,
Kalina, Santacruz (East), Mumbai - 400098
Tel: +91 2261073200 E-Mail: highwayinf@highwayconcessions.co.in Website: www.vertis.co.in

Extract of Statement of Unaudited Standalone Financial Results for the Quarter and Half year ended September 30, 2025

(All amounts in ₹ millions unless otherwise stated)					
Sl. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Half year ended	Year Ended
		September 30, 2025 (Unaudited)	September 30, 2024 (Unaudited)	September 30, 2025 (Unaudited)	March 31, 2025 (Unaudited)
1	Total Income from Operations	5,961.70	1,949.52	11,492.39	16,997.68
2	Net Profit for the period before Tax, Exceptional and/or Extraordinary items	3,544.13	1,206.18	7,608.52	13,904.58
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	3,116.05	(1,490.63)	6,871.19	9,019.50
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3,107.87	(1,503.33)	6,857.83	8,981.54
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	3,107.87	(1,503.33)	6,857.83	8,981.54
6	Unit Capital	1,28,610.63	73,597.34	1,28,610.63	1,28,610.63
7	Reserves (excluding Revaluation Reserve)	(20,588.66)	(19,427.29)	(20,588.66)	(18,958.72)
8	Net worth	1,08,021.97	54,170.05	1,08,021.97	1,09,651.91
9	Paid up Debt Capital / Outstanding Debt	1,08,417.12	35,451.98	1,08,417.12	47,860.67
10	Debt Equity Ratio (In times)	1.00	0.65	1.00	0.44
11	Earnings Per Unit (of Rs. 100/- each)				
	1. Basic:	2.06	(4.35)	4.54	9.67
	2. Diluted:	2.06	(4.35)	4.54	9.67
12	Debt Service Coverage Ratio (in times)	2.07	2.21	2.48	3.68
13	Interest Service Coverage Ratio (in times)	2.56	2.59	3.14	5.50

- Notes:
- The above results have been reviewed and recommended by the Audit Committee at their meeting held on November 06, 2025 and approved by the Board of Directors at their meeting held on November 07, 2025.
 - The above is an extract of the detailed format of Unaudited standalone Financial Results/Information for the Quarter and Half year ended September 30, 2025. Investors can view the full format of the Unaudited Standalone Financial Results/Information of Vertis Infrastructure Trust (the "Trust") for the Quarter and Half year ended September 30, 2025 on the Trust's website (www.vertis.co.in) or on the website of BSE Limited (www.bseindia.com).
 - For the other line items referred in regulation 52(4) & 54(3) of the Listing Regulations, pertinent disclosures have been made to the BSE Limited and can be accessed on the Trust's website (www.vertis.co.in) or on the website of BSE Limited (www.bseindia.com).

For and on behalf of the Board of Directors
Vertis Fund Advisors Private Limited
(Formerly known as "Highway Concessions One Private Limited")
(as Investment Manager of Vertis Infrastructure Trust ("formerly known as Highways Infrastructure Trust"))
Sd/-
Garvur Chandra
Executive Director and Joint CEO
DIN: 10312024
Place: Mumbai
Date: November 07, 2025

TATA POWER
(Corporate Contracts Department)
The Tata Power Company Limited, 2nd Floor, Sahar Receiving Station
Sahar Airport Road, Andheri East, Mumbai-400059
(Board Line: 022-57173917) CIN: L2820MH1918PLC009567
NOTICE INVITING TENDER (NIT)
The Tata Power Company Limited invites tenders from eligible vendors for the following packages (Two Part Bidding) in Mumbai:
A) Supply of Porta Cables at various sites (Package Reference CC26S8007)
B) Construction of drain for 220kV GIS at Kalyan (Package Reference CC26S8000)
For package A interested bidders to submit Tender Fee and Authorization Letter up to 1800 Hrs. Friday, 17th November 2025.
For detailed NIT and Tender documents, please visit Tender section on website <https://www.tatapower.com>. All future corrigendum (if any), to the subject tender shall be communicated on Tender section of website <https://www.tatapower.com> only.

બિજ સિક્યોરિટીઝ લીમીટેડ
CIN: L48101GJ1994PLC023772
સંસ્થાનું મુખ્ય મથક, બોમ્બે, રહેલો, સિટી બ્લોક નં. ૨૬, પ્લોટ નં. ૧૦૨૬૮૬, સુભાષનગર, ગુજરાત, મુંબઈ - ૪૦૦૦૨૯.
૩૦.૦૯.૨૦૨૫ ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને છ માસિક અનુભવિષ્ટ બહિષ્કારોનો સાર

અ. નં.	વિગત	ત્રિમાસિક અને છ માસિક સરેરાશ	સરવાળો	પાયાના વર્ષના ત્રિમાસિક સરેરાશ
૧	સામાન્ય બેંકો દ્વારા આપેલો	42.31	161.04	105.40
૨	આવકો બેંકો દ્વારા આપેલો (રોકડ) (રોકડ, સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૩	રોકડ પાત્રી આપકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૪	રોકડ પાત્રી આપકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૫	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૬	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૭	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૮	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૯	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૦	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૧	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૨	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૩	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૪	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૫	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૬	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૭	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૮	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૧૯	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૦	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૧	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૨	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૩	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૪	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૫	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૬	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૭	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૮	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૨૯	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35
૩૦	આવકો બેંકો દ્વારા આપેલો (સ્થાવર અને ચાલુ સ્થાવર સમાવેશ કરીને બેંકો દ્વારા)	39.25	176.34	100.35

નોંધ: આવારો (રોકડ/અનરોકડ) નોંધાયેલો, સરકાર ના નિયમો ૩૩ હેઠળ રોકડ એકત્રીકરણ પ્રમાણ રોકડ (ફાઇનાન્સ નાનાઈઝ્ડ પર્સનલિટી ઇન્ફોર્મેશન પર્સનલિટી સાર થી મુખ્ય છે). ફાઇનાન્સ નાનાઈઝ્ડ પર્સનલિટી ઇન્ફોર્મેશન પર્સનલિટી સાર થી સરકાર નો નિયમો ૩૩ હેઠળ રોકડ એકત્રીકરણ પ્રમાણ રોકડ (ફાઇનાન્સ નાનાઈઝ્ડ પર્સનલિટી ઇન્ફોર્મેશન પર્સનલિટી સાર થી મુખ્ય છે).
સરકાર ના નિયમો ૩૩ હેઠળ રોકડ એકત્રીકરણ પ્રમાણ રોકડ (ફાઇનાન્સ નાનાઈઝ્ડ પર્સનલિટી ઇન્ફોર્મેશન પર્સનલિટી સાર થી મુખ્ય છે).
સરકાર ના નિયમો ૩૩ હેઠળ રોકડ એકત્રીકરણ પ્રમાણ રોકડ (ફાઇનાન્સ નાનાઈઝ્ડ પર્સનલિટી ઇન્ફોર્મેશન પર્સનલિટી સાર થી મુખ્ય છે).
સરકાર ના નિયમો ૩૩ હેઠળ રોકડ એકત્રીકરણ પ્રમાણ રોકડ (ફાઇનાન્સ નાનાઈઝ્ડ પર્સનલિટી ઇન્ફોર્મેશન પર્સનલિટી સાર થી મુખ્ય છે).

step to green future

Ultimate Solution For Micro Irrigation

Solar EPC Services

captain

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER & HALF YEAR ENDED 30 SEPTEMBER 2025 (₹ in Lakhs)

Sr. No.	Particulars	Consolidated					
		Quarter Ended		Half Year Ended		Year Ended	
		30.09.2025	30.06.2025	30.09.2024	30.09.2025	30.09.2024	31.03.2025
		Unaudited	Unaudited	Audited	Unaudited	Audited	Audited
1	Total Income From Operations	7972.67	6974.20	5325.75	14946.87	11814.54	28684.34
2	Net Profit / (Loss) Before Tax	588.71	551.25	1924.09	1139.96	2338.95	3924.66
3	Net Profit / (Loss) After Tax	424.23	429.92	1627.42	854.15	1947.83	3132.28
4	Total Comprehensive Income for the Period	424.34	428.40	1621.24	852.74	1932.17	3134.16
5	Paid-up equity share capital	1198.58	1193.58	1107.58	1198.58	1107.58	1150.98
6	Earnings Per Share (EPS) not annualized (FV. Rs. 2/- each)						
	Basic EPS	0.71	0.73	2.94	1.42	3.52	5.65
	Diluted EPS	0.71	0.73	2.94	1.42	3.52	5.54

Note: (1) The above Unaudited Consolidated Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 08 November, 2025. The statutory auditors of the Company have carried out limited review of the financial results for the quarter and half year ended 30 September 2025. (2) The above Financial Results have been prepared in accordance with the applicable Indian Accounting Standards as prescribed u/s 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and other recognized accounting practices and policies to the extent applicable.

(3) Standalone Financial Results as on 30 September 2025 are as under:

EXTRACT OF STATEMENT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER & HALF YEAR ENDED 30 SEPTEMBER 2025 (₹ in Lakhs)

Sr. No.	Particulars	Standalone					
---------	-------------	------------	--	--	--	--	--

